

ત્વરિત જાહેરાત માટે

સિટી ઓફ બ્રેમ્પટનના ભૂતપૂર્વ પ્રમુખ અને બ્રેમ્પટનવાસી બિલ ડેવિસની જીવનયાત્રાને સલામી આપશે

બ્રેમ્પટન સીટી હોલ પર શોક પુસ્તિકા ઉપલબ્ધ છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (12 ઓગસ્ટ 2021) – સિટી ઓફ બ્રેમ્પટન આખા દેશ સાથે માનનીય શ્રી વિલિયમ (બિલ) ગ્રેનવિલ ડેવિસ PC, CC, OOnt, Qcના ઓગસ્ટ 8, 2021ના રોજ થયેલ સ્વર્ગવાસથી શોકાકુલ છે, જેઓ "બ્રેમ્પટન બિલીના હુલામણા નામે ઓળખાતા હતાં. પ્રમુખ ડેવિસે 1971 થી 1985 સુધી ઓન્ટારિયોના 18માં પ્રમુખ તરીકે પ્રોવિન્સને સેવા આપી હતી. આ પહેલા, શ્રી ડેવિસ પીલ ('59-'67), પીલ ઉત્તર ('67-'75) અને બ્રેમ્પટન ('75-'85) મત વિસ્તારોમાં MPP તરીકે સેવા આપી ચૂક્યા હતાં.

ઓગસ્ટ 8ના રોજ સિટીએ તમામ સવલતો પરના ધ્વજો ઉતારી સલામી આપી હતી અને પ્રમુખ ડેવિસની સ્મૃતિમાં સિટી હોલના કલોક ટાવરની બત્તીઓ ઝાંખી કરી હતી. શોક પુસ્તિકા ઓગસ્ટ 27મી સુધી સિટી હોલના અગ્ર દ્વાર પર સખ્તાહના કામકાજના દિવસોમાં સવારે 8:30 વાગ્યાથી સાંજે 4:30 દરમિયાન જાહેર જનતાના સદસ્યો માટે ઉપલબ્ધ હશે જેમને તેઓને અંજલિ આપવાની ઈચ્છા હોય.

ગઈકાલે સિટી કાઉન્સિલની સામાન્ય બેઠકમાં, બ્રેમ્પટન સિટી કાઉન્સિલના સભ્યોએ થોડા પળનું મૌન પાળ્યું હતું અને શ્રી ડેવિસના બ્રેમ્પટનમાં તેમજ પ્રોવિન્સ અને દેશના જાહેરજીવન અંગેના નોંધપાત્ર યોગદાન વિશેની સ્મૃતિઓ વાગોળી હતી. જુલાઈના પ્રારંભમાં સિટી કાઉન્સિલે ભૂતપૂર્વ બ્રેમ્પટન મેયર પીટર રોબર્ટસનની વિનંતી મંજૂર રાખી હતી કે \$1,00,000 ભૂતપૂર્વ પ્રમુખ ડેવિસને સન્માનિત કરવા માટેના સ્મારક માટે પ્રતિબદ્ધ રાખવામાં આવે.

નવેમ્બર 2019માં શ્રી ડેવિસને બ્રેમ્પટનની "કી ટૂ દ સિટી" મેયર પેટ્રિક બ્રાઉનના હસ્તે પ્રાપ્ત થઈ હતી. "કી ટૂ દ સિટી" એ એક પ્રતીકાત્મક સન્માન છે જે નગરપાલિકા સમાજના મોભીને પ્રદાન કરે છે, અથવા શહેરના પ્રખ્યાત અથવા પ્રતિષ્ઠિત અતિથિને અર્પે છે, જેમણે શહેરના નિવાસીઓના જીવન પ્રભાવિત કર્યા હોય.

સપ્ટેમ્બર 2021માં તેમની ખાનગી અંતિમયાત્રા સાથે તેમની જીવનયાત્રાને જાહેર સલામી અપાશે. પરિવાર સાથેના પરામર્શ બાદ, કેથી ડેવિસને પુષ્પાંજલિ આ સરનામે મોકલી શકાશે 61 Main St. S, બ્રેમ્પટન, ON L6Y 1M9. પ્રમુખ ડેવિસની સ્મૃતિમાં નિવાસીઓ પોતાની પસંદગીની સખાવતી સંસ્થાને દાન પણ આપી શકે છે.

મૃત્યુનોંધ

- [વિલિયમ ગ્રેનવિલ ડેવિસ મૃત્યુનોંધ - બ્રેમ્પટન, ઓન્ટારિયો | વોર્ડ ફ્યુનરલ હોમ્સ](#)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca